

પ્રેસ નોટ

માનનીય ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા નાઓના વરદ હસ્તે અમદાવાદ શહેર ખાતે મહીલા પોલીસ સ્ટેશન પુર્વ અને મહીલા પોલીસ સ્ટેશન પશ્ચિમ નુ શુભારંભ તેમજ નવનિર્મીત શાહીબાગ પોલીસ સ્ટેશનનુ લોકાર્પણ

અમદાવાદ શહેર ખાતે મહીલાઓની સુરક્ષા તથા તેઓની ફરીયાદોના સત્વરે નિવારણ માટે મહીલા પોલીસ સ્ટેશન (પુર્વ) રાણી સતીના મંદીર પાસે, શાહીબાગ અમદાવાદ તેમજ મહીલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ) અમદાવાદ મેનેજમેન્ટ એસોશીએશન ની સામે પાંજરાપોળ વસ્ત્રાપુર ખાતે ગઈ કાલ તા.૧૮/૦૪/૧૭ ના રોજ માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગૃહ વિભાગ, શ્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા ના વરદ હસ્તે રાખવામાં આવેલ હતુ અને આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડો.નિર્મલા સુનીલ વાઘવાની માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી મહીલા અને બાળ કલ્યાણ ,ગુજરાત રાજ્ય તેમજ અતિથિ વિશેષ સુશ્રી લીલાબેન અંકોલિયા ચેરપર્સન, ગુજરાત રાજ્ય મહીલા આયોગ તથા સુશ્રી જ્યોતિબેન વાઘાણી ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય મહીલા સુરક્ષા સમિતિ તથા શ્રી રાકેશભાઈ શાહ માનનીય ધારાસભ્ય શ્રી, એલીસબ્રીજ વિધાનસભા મતવિસ્તાર તથા શ્રી રજનીકાન્તભાઈ એમ.પટેલ માનનીય ધારાસભ્ય શ્રી, અસારવા વિધાનસભા મતવિસ્તાર તેમજ વિશેષ ઉપસ્થિતિમાં શ્રી એ.કે.સિંઘ,IPS પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર નાઓ હાજર રહેલ હતા તેમજ મહીલા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થા તથા એકમોના સભ્યો પણ હાજર રહેલ

ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન મહીલા બેન્ડ તથા ઘોડેસવાર દ્વારા માનનીય ગૃહ મંત્રી શ્રી નુ સ્વાગત કરવામાં આવેલ તેમજ મહીલા બાઈક રેલી નુ તેઓના હસ્તે “ફ્લેગ ઓફ “ આપી પ્રસ્થાન કરાવેલ તેમજ માનનીય ગૃહમંત્રી શ્રી દ્વારા શહેરની બે મહીલાઓ (૧) સુશ્રી રક્ષા માનાભાઈ ચૌધરી (૨) માહેનુર હુસેનમીયાં સૈયદનાઓને તેમની વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરી તેઓને પ્રસંશાપત્ર પણ આપવામાં આવેલ છે તેમજ કાર્યક્રમ દરમ્યાન ગાંધીજીના આદર્શોને લગતી અને મહેલાઓને લગતા તમામ કાયદાઓને સાંકળી લેતી બે પુસ્તિકાઓનુ વિમોચન અને વિતરણ કરવામાં આવેલ. અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ વખત ઉપરોક્ત બંને પોલીસ સ્ટેશનોમાં “ચિલ્ડ્રન ડ્રુમ અને કાઉન્સિલીંગ ડ્રુમ “ ની શરુઆત કરવામાં આવેલ છે.

આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જે.કે.ભટ્ટ, IPS સંયુક્ત પોલીસ કમિશ્નર, કાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા શ્રી ડી.બી.વાઘેલા, IPS અધિક પોલીસ કમિશ્નર,સેક્ટર-૨, અમદાવાદ શહેર તથા પરીક્ષિતા રાઠોડ, IPS નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-૪,અમદાવાદ શહેર તથા ટીપન ભદ્રન,IPS નાયબ પોલીસ કમિશ્નર, કાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરનાઓ દ્વારા ઘણુજ સુંદર આયોજન કરવામાં આવેલ છે.